

RUPAREL FOOD PRODUCTS LIMITED

(Formerly known as Mehta Housing Finance Limited)

Regd. Off: Plot No. 1A, Revenue Survey No 203, Savarkundla Road, Taveda, Mahuva Bhavnagar,
Gujarat - 364290

CIN: L15100GJ1993PLC020699

M: 98989 08652

Email: mehtahousingfinanceltd@gmail.com

Website: www.ruparelfoods.com

November 17, 2025

To,
General Manager,
The Department of Corporate Services - CRD,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai – 400 001

Dear Sir/Madam

Scrip Code: 511740

Subject: Newspaper Cutting of abridged Un-Audited (Standalone & Consolidated)
Financial Results for the Quarter & Half Year ended September 30, 2025

In compliance with Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the abridged un-audited (Standalone & Consolidated) Financial Results of the Company for the quarter ended & half year ended September 30, 2025, have been published in Gujarati newspaper in Gujarati language and English newspaper in English language on November 16, 2025.

We are enclosing herewith the above-mentioned newspaper clippings for your information and records.

Kindly take the above on record.


Thanking you.

Your faithfully

For Ruparel Food Products Limited
(F.K.A.Mehta Housing Finance Limited)

Khyati Gandhi
Company Secretary & Compliance officer
Membership No: A62422
Encl: a/a

Sanatan philosophy is integral human philosophy: Mohan Bhagwat




MERCURY EV-TECH LIMITED

(CIN: L27109GJ1986PLC008770)
(Reg Office: Block No. 28, National Highway No. 8, Manglej, Vadodara, Karjan, Gujarat, India, 391243)
E-mail Id: cs@mercuryevtech.com website: <https://mercuryevtech.com/>
Phone No: +91 265 2222777

UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED ON 30th SEPTEMBER , 2025

Pursuant to Regulation 33 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, based on the recommendation of the Audit Committee, the Board of Directors of Mercury EV-Tech Limited ('the Company') at its meeting held on November 14, 2025 has approved the Unaudited Financial Results for the quarter and half year ended on September 30, 2025 along with Limited Review Report submitted by the Statutory Auditors.

The aforementioned Audited Financial results along with the Limited Review Report of the Statutory Auditors thereon are available on <https://mercuryevtech.com/investor.html> and the said financial results can also be accessed by scanning the following Quick Response (QR) Code:



For Mercury EV-Tech Limited
Sd/-
Jayesh Raichandbhai Thakkar
Chairman & Managing Director
DIN-01631093

Date:- 16.11.2025
Place:- Vadodara

Pioneering Next-Gen Denim Fabric Creation

Experience the Finest Denim Creations that Elevate Comfort and Delight Customers



Rhythm & Blue

R & B DENIMS LTD

Revenue 21,524.02 Lakhs

EBITDA 3,207.46 Lakhs

PAT 1,635.54 Lakhs

EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULT FOR THE QUARTER AND HALF YEAR ENDED 30TH SEPTEMBER, 2025

Sr. No.	PARTICULARS	Standalone (Amount in Lakhs except EPS)					
		Three Months Ended			Six Months Ended		
		30.09.2025 Unaudited	30.06.2025 Unaudited	30.09.2024 Unaudited	30.08.2025 Unaudited	30.08.2024 Unaudited	31.03.2025 Audited
1.	Total Income from Operations*	6,376.75	7,425.35	5,841.28	13,802.10	10,801.74	24,791.18
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	642.66	808.15	565.66	1,450.81	1,177.83	2,738.13
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items)	642.66	808.15	565.79	1,450.81	1,179.38	2,739.68
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	460.33	610.48	418.90	1,070.81	873.45	2,091.84
5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax))	457.50	611.22	411.62	1,068.72	867.76	2,096.22
6.	Equity Share Capital	1,799.47	1,799.47	1,799.47	1,799.47	1,799.47	1,799.47
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited/Unaudited Balance Sheet of the previous year	-	-	-	-	-	16,497.14
8.	Earnings Per Share (face value of Rs. 2/-each) (for continuing and discontinued operations) Basic Diluted	0.51 0.51	0.68 0.68	0.46 0.46	1.19 1.19	0.96 0.96	2.33 2.33

Place : Surat
Date : 15.11.2025

R & B Denims Ltd.
CIN:L17120GJ2010PLC062949.
Regd. Office : Block No.467, Sachin Palsana Road, Palsana, Surat - 394315, Gujarat, India.
Tel : + 91 9601281648, Website : www.rmbdenims.com, Email : info@rmbdenims.com



For R&B Denims Ltd.
Sd/-
Amit Dalmia
Chairman and Managing Director
DIN: 00034642



Jaipur, Rashtriya Swayamsevak Sangh Sarsanghchalak Mohan Bhagwat said on Saturday that Pandit Deendayal Upadhyaya articulated Sanatan philosophy for the modern world by presenting it as Integral Human Philosophy in accordance with the needs of the country, time, and circumstances.

He said that although this philosophy was formally presented 60 years ago, its relevance today extends across the world.

Bhagwat was delivering the Deendayal Memorial Lecture organised by the Integral Human Philosophy Research and Development Foundation in Jaipur. He pointed out that the essence of Integral Human Philosophy can be understood in one word, Dharma.

Clarifying that Dharma does not refer to religion, sect, or creed, he said it signifies a destination and a universal outlook that accommodates all.

At present, he said, the world must adopt this Dharma of Integral Human Philosophy. He noted that historically, Indians have never exploited or harmed others when travelling abroad, and instead contributed positively wherever they went.

"While lifestyles, food habits, and clothing in India have changed over time, the eternal philosophy of integral humanism has remained intact," he said.

Its foundation, he said, is the belief that happiness lies within oneself.

"Recognising this inner happiness leads to the understanding that the entire world is one. Integral humanism is a philosophy free from extremism," he emphasised.

Speaking about physical, mental, and intellectual strength, Bhagwat said that all forms of power have limits.

The need of the hour, he added, is to pursue personal development while remaining committed to the welfare of all. Citing frequent global economic disruptions, he said India

remains relatively less affected because its economic strength is rooted in its family structure.

Commenting on rapid scientific progress, Bhagwat said that while material comforts have increased, peace and satisfaction have not. He questioned whether health has truly improved despite new medicines, pointing out that some illnesses arise due to certain treatments.

He further noted that only 4 per cent of the global population uses 80 per cent of the world's resources, widening the gap between developed and underdeveloped nations.

He said that India has always had diversity, but it has never been a source of conflict – rather, a source of celebration.

"Indian society accommodated countless deities and continued to welcome more without any difficulty. The world acknowledges the existence of happiness for the body, mind, and intellect, but not how to achieve all three together," he said. According to Bhagwat, India uniquely understands this because it believes in the holistic happiness of the body, mind, intellect, and soul.

Earlier, Mahesh Sharma, President of the Integral Human Philosophy Research and Development Foundation,

introduced the program.

He said that the entire universe is interconnected, and even the movement of a single particle has an impact on the whole. He also noted that this year marks the 150th anniversary of the composition of Vande Mataram, emphasising the importance of singing the full song in the present circumstances. The event was attended by several dignitaries, including Rajasthan Deputy Chief Minister Diya Kumari, Deputy Chief Minister Premchand Berwa, former Chief Minister Vasundhara Raje, BJP State President Madan Rathore, State Ministers Kirodi Lal Meena and Rajyavardhan Rathore, Rajya Sabha MP Ghanshyam Tiwari, former Minister Rajendra

ACE MEN ENGG WORKS LIMITED

CIN: L27109GJ1986PLC008770
Address: Office No. 16, Gulab Tower, Thaltej, Ahmedabad - 380054
Email Id: acemenengg@gmail.com | Website: www.acemenengginers.co.in


(Extract of Standalone unaudited Financial Result for the Quarter and half year ended 30th September, 2025)

Sr. No.	Particulars	Quarter ended			Half Year ended			Year ended 31st March, 2025 Audited
		30th September, 2025 Unaudited	30th June, 2025 Unaudited	30th September, 2024 Unaudited	30th September, 2025 Unaudited	30th September, 2024 Unaudited		
		1	Total Income from operations	2.56	4.64	-	7.20	
2	Net Profit/(Loss) for the Period before tax and exceptional items	1.22	1.81	-1.44	3.03	0.02	-2.08	
3	Net Profit/(Loss) before tax after exceptional items	1.22	1.81	-1.44	3.03	0.02	-2.08	
4	Net Profit/(Loss) after Tax and Exceptional Items	1.07	1.43	-1.44	2.5	-0.27	-2.08	
5	Total Comprehensive Income	1.43	1.17	-	3.03	0.02	-2.08	
6	Paid-up Equity Share Capital	309.85	309.85	309.85	309.85	309.85	309.85	
7	Earning Per Share							
	Basic	0.03	0.05	-0.05	0.08	-0.01	-0.07	
	Diluted	0.03	0.05	-0.05	0.08	-0.01	-0.07	

Notes: The above is an extract of the detailed format of unaudited Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full financial results are available on Stock Exchange website (www.bseindia.com) and on the Company's website (www.acemenengginers.co.in)

For Ace Men Engg Works Limited
Sd/-
RUCHIR BHAIJESHBHAI PATEL
Managing Director
DIN: 09840660

Place: Ahmedabad
Date: 15/11/2025



SUVIDHAA INFOSERVE LIMITED

(CIN: L72806GJ2007PLC00642)
Registered Office: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-SC, Zone-5, GIFT City Gandhinagar 382355
Corporate Office: 14, Olympus Industrial Estate, Off Mahakali Caves Road, Andheri (East), Mumbai 400093
Tel.: + 91 9223225225 | E-mail: cs@suvidhaa.com | Website: www.suvidhaa.com


Extract of Consolidated and Standalone Un-audited Financial Results for the quarter and half year ended September 30, 2025

(Rs. In millions)

Sr No	Particulars	Consolidated						Standalone					
		Quarter ended			Half Year ended			Quarter ended			Half Year ended		
		30.09.2025 (Un-audited)	30.06.2025 (Un-audited)	30.09.2024 (Un-audited)	30.08.2025 (Un-audited)	30.08.2024 (Un-audited)	31.03.2025 (Audited)	30.09.2025 (Un-audited)	30.06.2025 (Un-audited)	30.09.2024 (Un-audited)	30.08.2025 (Un-audited)	30.08.2024 (Un-audited)	31.03.2025 (Audited)
1	Total Income from Operations (net)* *(This includes other income)	10.24	16.28	35.43	26.52	79.07	111.76	1.12	9.35	29.17	10.47	67.29	119.68
2	Net Profit / (Loss) for the period (before Depreciation, Tax, Exceptional and/or Extraordinary Items)	-15.52	-40.54	-13.55	-56.07	-30.40	-77.13	-12.97	-2.78	-8.19	-15.76	-16.08	-16.54
3	Net Profit / (Loss) for the period before Tax (before Exceptional and/or Extraordinary Items)	-17.63	-43.00	-38.90	-60.63	-78.40	-165.87	-14.20	-4.31	-33.10	-18.52	-63.29	-102.84
4	Net Profit / (Loss) for the period before tax (after Exceptional &/or Extraordinary Item)	-17.63	-43.00	-38.90	-60.63	-78.40	-165.87	-14.20	-4.31	-33.10	-18.52	-63.29	-102.84
5	Net Profit / (Loss) for period after tax (after Exceptional &/or Extraordinary Items)	-17.63	-43.00	-38.90	-60.63	-78.40	-165.87	-14.20	-4.31	-33.10	-18.52	-63.29	-102.84
6	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-17.63	-43.00	-38.90	-60.63	-78.40	-169.23	-14.20	-4.31	-33.10	-18.52	-63.29	-114.10
7	Paid-up Equity Share Capital (Face value of Rs. 10/- each)	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81	209.81
8	Reserve (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-	-	164.83	-	-	-	-	-	923.01
9	Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations) - 1. Basic (Not annualized); 2. Diluted (Not Annualized);	-0.08 -0.08	-0.20 -0.20	-0.19 -0.19	-0.29 -0.28	-0.37 -0.37	-0.79 -0.78	-0.07 -0.07	-0.02 -0.02	-0.16 -0.16	-0.09 -0.09	-0.30 -0.30	-0.49 -0.48

The above is an extract of the detailed format of the Un-audited Financial Results (Standalone and Consolidated) for the quarter and half year ended September 30, 2025, the same has been filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full formats are available on the website of the Stock Exchange(s) at www.bseindia.com and www.nseindia.com and the Company's website at www.suvidhaa.com/financial-results.html

Date: November 14, 2025
Place: Mumbai



For and on behalf of Suvidhaa Infoserve Limited
Sd/-
Naresh Sharma Managing Director
DIN: 09071085

Rathore, RSS All India Co-Promotional Chief Arun Jain, All India Co-Organisational Chief Anil Oak, Regional Sanghchalak Ramesh Agarwal, and Regional Pracharak Nimbaram. S.S. Agarwal, Director of the Health Welfare Group, proposed the vote of thanks, and Narbada Indoria conducted the proceedings.



NHC FOODS LIMITED

CIN : L15122GJ1992PLC076277
Regd. Office - Survey No. 777, Umarsadi Desaiwad Road, at Village Umarsadi, Taluka Pardi,Valsad, Killa Pardi, Gujarat, India, 396175
Telephone: 91 22 69875000; Email : grievances@nhcgroup.com Website : www.nhcgroup.com
(Rs. in Lakhs except EPS)

EXTRACT OF STATEMENT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025


Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended			Year Ended March 31, 2025 Audited
		September 30, 2025 Unaudited	June 30, 2025 Unaudited	September 30, 2024 Unaudited	September 30, 2025 Unaudited	September 30, 2024 Unaudited		
		1	Total Income from operations (net)	10,320.73	11,050.90	6,617.08	21,371.62	
2	Net Profit/(Loss) for the period before Tax	221.23	225.96	212.17	447.19	392.10	858.60	
3	Net Profit/(Loss) for the period after Tax	134.91	166.60	208.68	301.51	370.31	669.42	
4	Total Comprehensive Income for the period	133.68	166.25	209.93	299.93	368.32	693.77	
5	Paid-up Equity Share Capital-Face Value of Rs. 1/- each (Split from its 10)	5,527.50	5,527.50	1,185.50	5,527.50	1,185.50	5,527.50	
6	Other Equity (excluding Revaluation reserve) as shown in the Balance Sheet of previous year	-	-	-	2,810.53	1,959.86	2,285.28	
7	Basic Earning per Share (EPS) (in Rs.)	0.02	0.03	(1.06)	0.05	0.31	0.31	
8	Diluted Earning per Share (EPS) (in Rs.)	0.02	0.03	0.24	0.05	0.43	0.31	

EXTRACT OF STATEMENT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2025

Sr. No.	Particulars	Quarter Ended			Half Year Ended			Year Ended March 31, 2025 Audited
		September 30, 2025 Unaudited	June 30, 2025 Unaudited	September 30, 2024 Unaudited	September 30, 2025 Unaudited	September 30, 2024 Unaudited		
		1	Total Income from operations (net)	10,320.73	11,050.90	6,617.08	21,371.62	
2	Net Profit/(Loss) for the period before Tax	221.23	225.96	208.57	447.19	427.78	897.36	
3	Net Profit/(Loss) for the period after Tax	134.01	166.60	206.08	301.61	406.07	708.18	
4	Total Comprehensive Income for the period	133.08	166.25	206.31	299.93	403.98	732.53	
5	Paid-up Equity Share Capital-Face Value of Rs. 1/- each (Split from Rs. 10)	5,927.50	5,927.50	1,185.50	5,927.50	1,185.50	5,927.50	
6	Other Equity (excluding Revaluation reserve) as shown in the Balance Sheet of previous year	-	-	-	2,845.85	1,994.33	2,285.28	
7	Basic Earning per Share (EPS) (in Rs.)	0.02	0.03	0.34	0.05	-	0.33	
8	Diluted Earning per Share (EPS) (in Rs.)	0.02	0.03	0.47	0.05	-	0.33	

Notes:-

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full Format of the Quarterly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and the Company's website (www.nhcgroup.com).
- The above results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on November 14, 2025. The Statutory auditors have carried out the limited review of the results.



For NHC FOODS LIMITED
Sd/-
SATYAM JOSHI
MANAGING DIRECTOR
(DIN:03638866)

Place: Mumbai
Date : November 15, 2025

RUPAREL FOOD PRODUCTS LIMITED

(Formerly known as Mehta Housing Finance Limited)
Regd. Off: Plot No. 1A, Revenue Survey No 203, Savarkundla Road, Tavoda, Mahuva Bhavnagar, Gujarat - 364200
CIN: L15100GJ1993PLC020699 M: 98909 08652
Email: mehtahousingfinance@mehtahousing.com Website: www.mehtahousing.com

Extract of Un-Audited Standalone Financial Results for the Quarter & Half Year ended September 30, 2025

(Rs. in Lakhs)

Particulars	Quarter Ended			Half Year Ended			31st March 2025 Audited (FY 24-25)
	30th September, 2025 Unaudited	30th September, 2024 Unaudited	30th June, 2025 Unaudited	30th September, 2025 Unaudited	30th September, 2024 Unaudited		
	Total Income	233.16	0.00	0.00	233.16	204.40	
Total expenses	233.72	7.57	5.38	241.29	213.75	512.16	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary Items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary Items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Paid up Equity Share Capital (No of Share) (Face Value: Rs. 10/- each)	30.82	30.82	30.82	30.82	30.82	30.82	
Earnings per equity share (for discontinued & continuing operations)							
(1) Basic	-0.02	-0.25	-0.17	-0.26	-0.30	-0.44	
(2) Diluted	-0.02	-0.25	-0.17	-0.26	-0.30	-0.44	

Notes:

- The above is an extract of the detailed format of Un-audited Standalone Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- The said Financial Results were reviewed by the Audit Committee and then approved by the Board of Directors at their Meeting held on November 14, 2025, along with the report thereon.
- The said results along with the limited review report of the statutory auditors are available on BSE Limited ("BSE") website (URL: www.bseindia.com) and on the Company's website (URL: www.ruparelfoods.com).
- Previous years' Quarters figures have been regrouped/ rearranged wherever necessary to make them comparable.

Extract of Un-Audited Consolidated Financial Results for the Quarter & Half Year ended September 30, 2025

(Rs. in Lakhs)

Particulars	Quarter Ended			Half Year Ended			31st March 2025 Audited (FY 24-25)
	30th September, 2025 Unaudited	30th September, 2024 Unaudited	30th June, 2025 Unaudited	30th September, 2025 Unaudited	30th September, 2024 Unaudited		
	Total Income (I+II)	233.16	0.00	0.00	233.16	204.40	
Total expenses (IV)	233.72	7.57	5.38	241.29	213.75	512.16	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or extraordinary items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or extraordinary Items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or extraordinary Items)	-0.56	-7.57	-5.38	-8.13	-9.35	-13.66	
Other Comprehensive Income :							
Share of Profit / (Loss) of Investment in an associate accounted for using equity method	8.23	6.66	-4.69	14.89	1.65	-8.36	
Total Comprehensive Income for the period Comprising Profit (Loss) and Other Comprehensive Income for the period	7.67	-0.91	-10.07	6.76	-7.70	-22.02	
Paid up Equity Share Capital (No of Share) (Face Value: Rs. 10/- each)	30.82	30.82	30.82	30.82	30.82	30.82	
Earnings per equity share (for discontinued & continuing operations)							
(1) Basic	0.25	-0.03	-0.33	0.22	-0.25	-0.71	
(2) Diluted	0.25	-0.03	-0.33	0.22	-0.25	-0.71	

Notes:

- The above is an extract of the detailed format of Un-audited Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
- The said Financial Results were reviewed by the Audit Committee and then approved by the Board of Directors at their Meeting held on November 14, 2025, along with the report thereon.
- The said results along with the limited review report of the statutory auditors are available on BSE Limited ("BSE") website (URL: www.bseindia.com) and on the Company's website (URL: www.ruparelfoods.com).
- Previous years' Quarters figures have been regrouped/ rearranged wherever necessary to make them comparable.



For Ruparel Food Products Limited (P.K.A. Mehta Housing Finance Limited)
Sd/-
Pankaj Ruparel
Chairman and Director
DIN: 00077676

Date: 14-11-2025
Place: Mahuva

